

પ્રતિ,
તંત્રીશ્રી,
દૈનિક.....

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૧લી ડિસેમ્બર “વર્લ્ડ એઇડ્સ ડે” અંતર્ગત
જનજાગૃતિ અભિયાન તેમજ એવોર્ડ એનાયત સમારંભ મેયર ડૉ.પ્રદિપ ડવના
અધ્યક્ષ સ્થાને યોજાયો.

તબીબી ક્ષેત્રે વિશ્વભરમાં ભારતનું મોટું યોગદાન રહ્યું છે અને આ ક્ષેત્રે હજુ
વધુને વધુ સારી સુવિધા આપવા આપણે કટિબધ્ધ છીએ. - ડૉ.પ્રદિપ ડવ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૧ લી ડિસેમ્બર “વર્લ્ડ એઇડ્સ ડે” અંતર્ગત
આજ તા.૦૧/૧૨/૨૦૨૧ના રોજ જનજાગૃતિ અભિયાન તેમજ એવોર્ડ એનાયત
સમારંભ મેયર ડૉ. પ્રદિપ ડવના અધ્યક્ષ સ્થાને યોજાયેલ હતો.

આ પ્રસંગે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી,
ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, શાસકપક્ષ નેતા
વિનુભાઈ ઘવા, ઇંડક શાસકપક્ષ સુરેન્દ્રસિંહ વાળા, પ્રોજેક્ટ ડાયરેક્ટર ગુજરાત રાજ્ય
એઇડ્સ કંટ્રોલ સોસાયટી ડૉ.રાજેશ ગોપાલ, આરોગ્ય સમિતિ ચેરમેન
ડૉ.રાજેશ્રીબેન ડોડીયા તથા સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન પરેશભાઈ પીપળીયા,
ડે. કમિશનર આશિષકુમાર, એ.આર.સિંહ તેમજ આરોગ્ય અધિકારી ડૉ.એલ.ટી.વાંઝા,
ડૉ.પી.પી.રાહોડ, ડૉ.મનિષ યુનારા તેમજ એવોર્ડના લાભાર્થીઓ તથા એઇડ્સ
સંસ્થાના હોટેદારશ્રીઓ ઉપસ્થિત રહેલ.

એચ.આઈ.વી. એઇડ્સ અંતર્ગત જે જે સંસ્થાઓ રાજ્યભરમાં કામગીરી કરેલ
તેવી ૪૨-સંસ્થાઓને એવોર્ડ આપવામાં આવેલ. આ ઉપરાંત જનજાગૃતિ માટે રેલીનું
પણ આયોજન કરવામાં આવેલ. તેમજ પદાધિકારીશ્રી દ્વારા એઇડ્સની જન જાગૃતિ
માટે સિગ્નેચર કેમ્પેઇન (સહી ઝુંબેશ) કરેલ.

આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ
દ્વારા કરવામાં આવેલ કાર્યક્રમનું શુભારંભ લક્ષ એન.જી.ઓ. ની ટીમદ્વારા પ્રાર્થનાથી

કરવામાં આવેલ તેમજ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ તેમજ મંચસ્થ મહાનુભાવોનું પુસ્તકથી સ્વાગત આરોગ્ય સમિતિ ચેરમેન ડૉ. રાજેશ્રીબેન ડોડીયા દ્વારા કરવામાં આવેલ તેમજ એઈડસ પ્રત્યે જન જાગૃતિ માટે એઈમ્સ રાજકોટના વિદ્યાર્થી દ્વારા નુક્કડ નાટક રજુ કરવામાં આવેલ

આ પ્રસંગે માન. ડૉ. પ્રદિપ ડવે જણાવેલ કે સાવચેતી દ્વારા એઈડસનો ઈલાજ શક્ય છે. તેમજ એઈડસગ્રસ્ત લોકો પ્રત્યે ધૃણા રાખવી ન જોઈએ તેમજ સમાજમાં આપણી પણ ફરજ છે કે લોકોને એચ.આઈ.વી. પ્રત્યે જાગૃત કરીએ અને સંક્રમણ ન વધે તે માટે માર્ગદર્શન આપીએ તેમજ સ્કુલ કોલેજો આદ્યોગિક વસાહતો વિગેરે ખાતે આ જાગૃતિના કાર્યક્રમો યોજી અને લોકોને માહિતગાર કરવા જરૂરી છે. અને એઈડસ પ્રત્યેની સમાજમાં રહેલ ગેરસમજ દુર કરવી જરૂરી છે. યોગ્ય સારવાર મળેતો એઈડસ અટકાવી શકાય છે. મેડીકલ ક્ષેત્રે વિશ્વમાંભારતનું શ્રેષ્ઠ યોગદાન છે. તેમજ ગુજરાત રાજ્ય તથા રાજકોટ શહેર પણ આરોગ્ય ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યું છે. તેમજ વધુ જણાવ્યું છે કે રાજ્ય ને રાજકોટને સલામત રાખવા આરોગ્ય ક્ષેત્રે વધુ ને વધુ સારી સેવા આપવા આપણે કટિબદ્ધ થઈએ.

કાર્યક્રમની રૂપરેખા આપતા પ્રોજેક્ટ ડાયરેક્ટર ગુજરાત રાજ્ય એઈડસ કંટ્રોલ સોસાયટી ડૉ.રાજેશ ગોપાલએ જણાવેલ કે એઈડસ એ જાગૃતિથી સંપૂર્ણ કંટ્રોલ કરી શકાય છે. રાજકોટની કામગીરી શરૂઆતથી જ સારી રહી છે. આપણે સાથે મળી તમામને માહિતગાર કરવા જરૂરી છે. સને-૨૦૧૭માં ૬૨ ૧,૦૦,૦૦૦ વ્યક્તિએ ૭-વ્યક્તિ એઈડસ ગ્રસ્ત હતાં. જ્યારે આજે ૬૨ ૧,૦૦,૦૦૦ વ્યક્તિએ ૩-વ્યક્તિ એઈડસ ગ્રસ્ત છે. જે જાગૃતિનું પરિણામ છે. આપણે સૌ એક જૂથ થઈ લોકોને જાગૃતિ માટે પ્રયાસો કરવા જોઈએ.

આ કાર્યક્રમની આભારવિધિ આરોગ્ય સમિતિ ચેરમેન ડૉ. રાજેશ્રીબેન ડોડીયા દ્વારા કરવામાં આવેલ હતી.

(પી.એ. ટુ મેયર)